

ઝોન :-

અનુક્રમ નં. :-

તારીખ :- ૧૫/૦૫/૨૦૨૩

૨૧૬૨૯ કલીયર સર્વેયીકેટ

NDK Buildcom Indig Pvt. Ltd.

High Street.

VADGAMA ASSOCIATES



ADVOCATE

ASHWIN N. VADGAMA

KUNJAN R. VADGAMA

MO. 94260 03077

10 - GOPAL NAGAR, GOPAL NAGAR MAIN ROAD, DHEBAR ROAD, RAJKOT.

VADGAMA ASSOCIATES

ASHWIN N. VADGAMA



KUNJAN R. VADGAMA

MO. 99048 43299

MO. 75750 43299

(Advocate) Gujarat High Court.

10 - Gopal Nagar, Rajkot-360002.

—:: ટાઈટલ કલીયર સર્ટીફિકેટ ::—

મીલકતના માલિક—

એન ડી કે બીલ્ડકોન ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ(PAN NO. : AAHCN 5883 C) વતી તેના ડાયરેક્ટર દરજજે તથા અન્ય ડાયરેક્ટર્સ વતી —

શ્રી નૈમીષ રશ્મીકાંત મહેતા,

ધર્મે : હિન્દુ, ઉ.વ.આ. ૩૪, ધંધો : વેપાર,

રહે. "પુષ્પમ", ૧ — વિદ્યાનગર, રાજકોટ.

રા. મ્યુનિ. કોર્પો. ની બાંધકામ પરવાનગી નં. 303, DT. 29 / 03 / 2023.

ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ રાજકોટના સબ-ડીસ્ટ્રીક્ટ રાજકોટના રાજકોટ શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની બહુહેતુક ઉપયોગ માટે બીનખેતી થયેલ સીંગલ યુનિટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૯૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ઉપર આવેલ "હાઈ સ્ટ્રીટ" ના નામથી ઓળખાતા બીલ્ડીંગનો સ્થાવર મિલકતનો ટાઈટલ કલીયર રીપોર્ટ આપવા અંગે.

સ્થાવર મિલકતનું વર્ણન :-

સદરહું મિલકતવાળી મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની બહુહેતુક ઉપયોગ માટે બીનખેતી થયેલ સીંગલ યુનિટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૯૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ખાતેદાર ખેડુત દરજજે શ્રી કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયા ધરાવતા હતા.

ઉપરોક્ત વિગતવાળી મુળ ખેતીની જમીન ગામ મવડી-૩ ના ખાતેદાર ખેડુત શામજીભાઈ નાનજીભાઈ ના નામે ખાતા નં. ૪૪ થી રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧ ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. ૩/૦૬/૫૫ ધરાવતા હતા, ત્યારબાદ શામજીભાઈ નાનજીભાઈએ પોતાની હયાતીમા વારસદારોના હક્ક દાખલ કરવા માટે અરજી આપતા કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયા વિગેરે-૮ ના નામ દાખલ થયેલ જે અંગેની નોંધ ગામ નમુના નં. ૬(હક્ક પત્રક)મા નોંધ નં. ૨૯૪૭, તા. ૦૩/૦૪/૨૦૧૨ થી પ્રમાણીત થયેલ.

.. ૨ ..



ત્યારબાદ મવડી-૩ ના ખાતેદાર ખેડુત શામજીભાઈ નાનજીભાઈ વિગેરે-૯ ના નામે ખાતા નં. ૪૪ થી રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧ ની ખેડવાણ જમીન હે.આરે.યો.મી. ૩/૦૬/૫૫ આવેલ તે જમીન માંથી શામજીભાઈ નાનજીભાઈ સોરઠીયા વિગેરે-૬ એ તેમનો હકક હીસ્સો ઉઠાવી લેતા તેઓના નામ કમી થયેલ જે અંગેની નોંધ ગામ નમુના નં. ૬ (હકક પત્રક) મા નોંધ નં. ૩૦૧૬, તા. ૦૮/૧૧/૨૦૧૨ થી પ્રમાણીત થયેલ.

ત્યારબાદ મવડી-૩ ના ખાતેદાર ખેડુત કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયા વિગેરે-૩ ના નામે ખાતા નં. ૪૪ થી રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧ ની ખેડવાણ જમીન હે.આરે.યો.મી. ૩/૦૬/૫૫ આવેલ તે જમીનની ઘરમેળેની સમજૂતીથી પોતાની રાજીખુશીથી ભાયો-ભાગની વહેચણી કરતા કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયાના ભાગે રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧ ની જમીન ક્ષેત્રફળ ૧/૪૪/૬૭ આવેલ જે અંગેની નોંધ ગામ નમુના નં. ૬ (હકક પત્રક) મા નોંધ નં. ૩૦૧૭, તા. ૦૮/૧૧/૨૦૧૨ થી પ્રમાણીત થયેલ.

ત્યારબાદ શ્રી કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયાએ રાજકોટ શહેર (દક્ષિણ) મા સમાવિષ્ટ થયેલ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ની જમીનનો લે-આઉટ પ્લાન આસી. ટાઉન પ્લાનર રાજકોટ મહાનગરપાલીકાની જમીન આંકવા / ભાગ કરવાની અરજીની મંજૂરી વર્ગીકરણ નં. ૨૩, તા. ૦૫/૧૧/૨૦૨૦ થી મંજૂર કરાવેલ.

ત્યારબાદ રાજકોટ શહેર (દક્ષિણ) મા સમાવિષ્ટ થયેલ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની ખેડવાણ જમીન પૈકી ચો.મી. ૫૦૩૮-૨૦ ને બીનખેડવાણ કરાવવા માટે કલેક્ટરશ્રી રાજકોટને અરજી કરતા કલેક્ટરશ્રી રાજકોટએ તેમના હુકમ નં. ૮૫/૦૮/૧૮/૧૧૨/૨૦૨૧, તા. ૨૫/૦૧/૨૦૨૧ થી બીનખેડવાણ કરી આપેલ છે અને તેની ગામ નમુનો નં. ૬ મા નોંધ નં. ૪૩૨૯ થી પ્રમાણીત થયેલ છે.

એ રીતે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની બહુહેતુક ઉપયોગ માટે બીનખેતી થયેલ સીગલ યુનીટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૮૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ઉપર વાણીજ્ય તથા રહેણાંક હેતુના બાંધકામ કરવા માટેની શ્રી કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયાએ રાજકોટ મહાનગરપાલીકામાંથી બાંધકામ પરવાનગી નં. ૩૦૩, તા. ૨૯/૦૩/૨૦૨૩ થી મેળવી તેનો બીલ્ડીંગ પ્લાન પાસ કરાવેલ છે અને તેવા તેઓના બાંધકામ કરવાના એફ.એસ.આઈ સહીતના તમામ હકકો અને અધીકારો સહીતની જમીન તેઓની માલિકીની થયેલ.

તે બાદ શ્રી કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયાએ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની બહુહેતુક ઉપયોગ માટે બીનખેતી થયેલ સીગલ યુનીટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૮૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ઉપર તેઓએ રાજકોટ મહાનગરપાલીકામાંથી મેળવેલ બાંધકામ પરવાનગી તથા મંજૂર કરાવેલ બીલ્ડીંગ પ્લાનના બાંધકામ કરવાના હકકો સહિત સદરહુ જમીન અનુ. નં. ૫૮૩૯, તા. ૨૯/૦૪/૨૦૨૩ ના વેચાણ દસ્તાવેજથી એન ડી કે બીલ્ડકોન ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ વતી તેના ડાયરેક્ટર દરજજે તથા અન્ય ડાયરેક્ટર્સ વતી શ્રી નૈમીષ રશ્મીકાંત મહેતાને વેચાણ આપેલ છે.



તે બાદ એન ડી કે બીલ્ડકોન ઈન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ વતી તેના ડાયરેક્ટર દરજજે તથા અન્ય ડાયરેક્ટર્સ વતી શ્રી નૈમીષ રશ્મીકાંત મહેતાએ સદરહું જમીન ઉપર રા.મ્યુ.કો.માથી મેળવેલ બાંધકામ પરવાનગી તથા મંજૂર કરાવેલ બીલ્ડીંગ પ્લાન અન્વયે સદરહું સીંગલ યુનીટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૮૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ઉપર રહેણાંક તથા વાણીજ્ય હેતુના ટાવર-એ થી ટાવર-ડી બીલ્ડીંગનું બાંધકામ કરવાનું આયોજન કરેલ છે જેમા ટાવર-એ (કોમર્શીયલ) ગ્રાઉન્ડ ફ્લોરમા તેર શોપ, એક સ્ટોલ, ત્રણ W.C., હેન્ડીકેપ W.C., બે યુરીનલ તથા સીડીનું બાંધકામ તથા ફર્સ્ટ ફ્લોરમા તેર શોપ, બે W.C., બે યુરીનલ, સીડી તથા પેસેજનું બાંધકામ તથા ટાવર-એ (રેસીડેન્સીયલ) ગ્રાઉન્ડ ફ્લોરમા કવર્ડ પાર્કિંગ, સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા 1st ફ્લોરમા લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા બે રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ (કુલ-બે રહેણાંક યુનીટ) તથા 2nd TO 5th, 7th, 9th TO 12th & 14th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ (કુલ-ચાલીસ રહેણાંક યુનીટ) તથા 6th, 8th & 13th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ (કુલ-ચાલીસ રહેણાંક યુનીટ) તથા 6th, 8th & 13th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા રેફ્યુજ એરીયા (કુલ-બાર રહેણાંક યુનીટ) તથા ટાવર-બી અને સી (રેસીડેન્સીયલ) ગ્રાઉન્ડ ફ્લોરમા કવર્ડ પાર્કિંગ, સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા 1st TO 5th, 7th, 9th TO 12th & 14th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ (કુલ-ચુમાલીસ રહેણાંક યુનીટ) તથા 6th, 8th & 13th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, ત્રણ બેડ રૂમ, બે W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા રેફ્યુજ એરીયા (કુલ-બાર રહેણાંક યુનીટ) તથા ટાવર-ડી (રેસીડેન્સીયલ) બેઝમેન્ટ ફ્લોરમા કવર્ડ પાર્કિંગ, સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ, પેસેજ તથા રેમ્પનું બાંધકામ તથા ગ્રાઉન્ડ ફ્લોરમા કવર્ડ પાર્કિંગ, સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા 1st TO 5th, 7th, 9th TO 12th & 14th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, બેડ રૂમ, સ્ટડીરૂમ, બાથ, W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ (કુલ-ચુમાલીસ રહેણાંક યુનીટ) તથા 6th, 8th & 13th FLOOR ઉપર લીવીંગ/ડાયનીંગ, કીચન, વોશ, બેડ રૂમ, સ્ટડીરૂમ, બાથ, W.C., એવા દરેક માળે ચાર રહેણાંક યુનીટ તથા સીડી, લીફ્ટ, ફાયર લીફ્ટ તથા પેસેજનું બાંધકામ તથા બે રેફ્યુજ એરીયા (કુલ-બાર રહેણાંક યુનીટ) તથા કોમન પ્લોટ - ગ્રાઉન્ડ ફ્લોરમા કોમન ફેસેલીટી, W.C., તથા ઓપન સીડીનું બાંધકામ તથા 1st FLOOR મા કોમન ફેસેલીટી, W.C. નું બાંધકામનું આયોજન કરેલ છે જે બીલ્ડીંગ "હાઈ સ્ટ્રીટ" ના નામથી ઓળખાય છે.

ઉપરોક્ત સ્થાવર મિલ્કતની અસલ તથા ખરી નકલોની ફાઈલ મારી પાસે અભીપ્રાય માટે રજુ થતા જે અંગેના ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આ સાથે સામેલ છે.

.. ૪ ..



// ૪ //

આથી હું નીચે સહી કરનાર શ્રી અશ્વિન એન. વડગામા, એમ.કોમ. એલ.એલ.બી. એડવોકેટ ગોપાલનગર શેરી નં. ૧૦, રાજકોટ. સદરહું મિલ્કત અંગે ૩૦ વર્ષનું સર્ચ કરી(પહોંચ નં. ૨૦૨૩૦૨૨૦૦૦૧૨૭૬૮, તા. ૧૫/૦૫/૨૦૨૩ તથા પહોંચ નં. ૨૦૨૩૦૨૩૦૦૦૧૭૧૮૩, તા. ૧૫/૦૫/૨૦૨૩ તથા પહોંચ નં. ૨૦૨૩૩૨૬૦૦૦૦૮૧૦૨, તા. ૧૫/૦૫/૨૦૨૩) અને તમામ સરકારી રેકર્ડ તપાસી અને પ્રાપ્ત થયેલ દસ્તાવેજોની વિગતોની ચકાસણી કરી છે અને ત્યારબાદ હું નિર્ણય પર આવ્યો છું તે મિલ્કતના ટાઈટલ મારી દ્રષ્ટીએ કલીયર, માર્કેટેબલ તેમજ કોઈપણ પ્રકારની વ્યાજબી શંકાઓ રહીત છે.

(૧) મિલ્કતનું વર્ણન, સ્થળ અને ચતુર્સીમા :-

રાજકોટ મહાનગરપાલીકાની હદમાં સમાવેશ કરવામાં આવેલ ગામ મવડી-૩ ના રેવન્યુ સર્વે નં. ૩૩૮ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની બહુહેતુક ઉપયોગ માટે બીનખેતી થયેલ સીંગલ યુનીટની જમીન ચો.મી.આ. ૪૫૩૪-૨૮ તથા સાર્વજનિક પ્લોટની જમીન ચો.મી.આ. ૫૦૩-૮૨ મળી કુલ જમીન ચો.મી.આ. ૫૦૩૮-૨૦ ઉપર આવેલ "હાઈ સ્ટ્રીટ" ના નામથી ઓળખાતા બીલ્ડીંગ આવેલ છે.

ચતુર્સીમા :

ઉત્તરે : ૨૪-૦૦ મીટરનો ટી. પી. મવડી રોડ આવેલ છે.

દક્ષિણે : પ્રપોઝડ ટી. પી. રીઝર્વેશન પ્લોટ આવેલ છે.

પૂર્વે : લાગુ સર્વે નં. ૩૩૮ પૈકી ની જમીન આવેલ છે.

પશ્ચિમે : લાગુ સર્વે નં. ૩૩૪ તથા ૩૩૫ ની જમીન આવેલ છે.

સદરહું સ્થાવર મિલ્કતના ઉત્તરોત્તર દસ્તાવેજો નીચે મુજબ છે.

ટાઈટલ ડીડઝ :-

૧. અનુ. નં. ૫૮૩૮, તા. ૨૮/૦૪/૨૦૨૩ નો વેચાણ દસ્તાવેજ એન ડી કે બીલ્ડકોન ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ વતી તેના ડાયરેક્ટર દરજજે તથા અન્ય ડાયરેક્ટર્સ વતી શ્રી નૈમીષ રશ્મીકાંત મહેતા જોગ શ્રી કિશોરભાઈ શામજીભાઈ સોરઠીયાએ કરી આપેલ છે તેની નકલ.
૨. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ બાંધકામ પરવાનગી નં. ૩૦૩, તા. ૨૮/૦૩/૨૦૨૩ તથા આરંભ પ્રમાણપત્ર તથા બાંધકામ પ્લાનની નકલ.
૩. રાજકોટના કલેક્ટર કચેરીમાંથી મેળવેલ બીનખેતી હુકમ નં. ૮૫/૦૮/૧૮/૧૧૨/૨૦૨૧, તા. ૨૫/૦૧/૨૦૨૧ નો છે તેની નકલ.
૪. રાજકોટ મહાનગરપાલીકામાંથી જમીન આંકવા / ભાગ કરવાની મંજૂરી વર્ગીકરણ નં. ૨૩, તા. ૦૫/૧૧/૨૦૨૦ ની ખરી નકલ તથા લે-આઉટની નકલ.
૫. પ્રમોલગેશનથી ઉત્તરોત્તર ગામ નમુના નં. ૬ (હકક પત્રક), ૭, ૧૨, ૮-અ ની નકલો.

.. ૫ ..




// ૫ //

૬. માપણી શીટ તથા હીસ્સા ફોર્મ નં. ૪ ની નકલ.

ઉપરોક્ત વર્ણનવાળી મિલ્કત ઉપર કોઈપણ પ્રકારનું કરજ, બોજો નથી કે સદરહું મિલ્કત ઉપર કોઈપણ પ્રકારની જામીનગીરી સ્વીકારેલ નથી. સદરહું મિલ્કત ઉપર અન્ય કોઈપણ જગ્યાએથી લોન લીધેલ નથી કે કોઈપણ પ્રકારના દાવા દુવી પેન્ડીંગ નથી તેવું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડેલ છે. આથી મારા સ્પષ્ટ અભિપ્રાય મુજબ સવાલવાળી મિલ્કતના ટાઈટલ કલીયર છે માર્કેટેબલ તથા ટાઈટલ કલીયર હોવાનું મારું માનવું છે.

રાજકોટ, તારીખ :- ૧૫/૦૫/૨૦૨૩




અશ્વિન એન. વડગામા
(એડવોકેટ)

Inspector General of Registration
Revenue Department, Government of Gujarat
અરજી પહોંચ

મિલકત નું વર્ણન : MAVDI-3 R.S.NO.338 PAIKI

Search in : MAVDI-3/MAVDI-3

પહોંચ નંબર ૨૦૨૩૦૨૨૦૦૦૧૨૭૬૮ અરજી નંબર ૮૧૮૧ અરજી વર્ષ ૨૦૨૩
તારીખ ૧૫ માહે મે સને ૨૦૨૩

રજુ કરનારનું નામ KUNJANKUMAR RAJNIKANTBHAI VADGAMA

ટ્રાન્ઝેક્સન નંબર 20230515459737148

નીચે પ્રમાણે ફી પહોંચી

૩. પૈસા

રજીસ્ટ્રેશન ફી.....
નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....
શેરોની નકલ કરવા માટે ફી.....
ટપાલ ખર્ચ.....
નકલો અથવા ચાટીઓ (કલમ ૬૪ થી ૬૭).....
શોધ અગર તપાસણી.....વર્ષ : 1993 થી 1998
દંડ કલમ-૨૫.....
કલમ-૩૪ (કલમ-૫૭).....
નકલ ફી ફોલીયો.....
ઈન્ડેક્સ-૨ ફી.....
અન્ય ફી

૭૦.૦૦

કુલ એકંદરે રૂ. ૭૦.૦૦

અંકે રૂપીયા સીત્તેર પુરા



A.M. Desai
સબ રજીસ્ટ્રાર
રાજકોટ - 1

Inspector General of Registration
Revenue Department, Government of Gujarat
અરજી પહોંચ

મિલકત નું વર્ણન : MAVDI-3 R.S. NO.338 PAIKI

Search in : મવડી /MAVDI

પહોંચ નંબર ૨૦૨૩૦૨૩૦૦૦૧૭૧૮૩

અરજી નંબર ૮૦૪૭

અરજી વર્ષ ૨૦૨૩

તારીખ ૧૫

માહે મે

સને ૨૦૨૩

રજુ કરનારનું નામ KUNJANKUMAR RAJNIKANTBHAI VADGAMA

દ્રાન્જેક્સન નંબર 20230515326756127

નીચે પ્રમાણે ફી પહોંચી

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા યાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....

શોધ અગર તપાસણી.....વર્ષ : 1998 થી 2012

ઈંડ કલમ-૨૫.....

કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી ફોલીયો.....

ઈન્ડેક્સ-૨ ફી

અન્ય ફી

રૂ. પૈસા

૧૬૦.૦૦

કુલ એકંદરે રૂ.

૧૬૦.૦૦

અંકે રૂપીયા એક સો સાઈઠ પુરા

A. N. Dasani

સબ રજીસ્ટ્રાર

રાજકોટ - 2

Inspector General of Registration
Revenue Department, Government of Gujarat
અરજી પહોંચ

મિલકત નું વર્ણન : MAVDI-3 R.S.NO.338 PAIKI

Search in : Mavdi/Mavdi

પહોંચ નંબર ૨૦૨૩૩૨૬૦૦૦૦૮૧૦૨

અરજી નંબર ૨૪૮૨

અરજી વર્ષ ૨૦૨૩

તારીખ ૧૫

માહે મે

સને ૨૦૨૩

રજુ કરનારનું નામ KUNJANKUMAR RAJNIKANTBHAI VADGAMA

ટ્રાન્ઝેક્સન નંબર 20230515179374555

નીચે પ્રમાણે ફી પહોંચી

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા ચાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....

શોધ અગર તપાસણી.....વર્ષ : 2012 થી 2023

ઈંડ કલમ-૨૫.....

કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી ફોલીયો.....

ઈન્ડેક્સ-૨ ફી

અન્ય ફી

રૂ. પૈસા



૧૩૦.૦૦

કુલ એકંદરે રૂ.

૧૩૦.૦૦

અંકે રૂપિયા એક સો ત્રીસ પુરા

T.N.PARMAR
સબ રજીસ્ટ્રાર

રાજકોટ - ૬ - મવડી